

આશુ ફૂટ રિહેબ સેન્ટરની અમૂલ્ય સેવાઓ

દરેક પ્રકારની પગની તકલીફ માટે દર્દીની જરૂરિયાત મુજબ ૧૦૦% માર્ગદર્શન, શુઝ અને ઈનસોલ આપવામાં આવે છે. અમારી પાસે ઈનસોલ મટિરીયલ, પેડીંગ, ઈમોલ્ડિંગ, કસ્ટમાઈઝડ શુઝ, ઉપરાંત તાલીમ તથા સંલગ્ન સેવાઓ ત્વરિત ધોરણે મળશે.

આશુ ફૂટ રિહેબ થી યતા ફાયદા

- હાડકાના બંધારણમાં થતી અનિયમિતતાની વિપરીત અસરને ખાળવા ઉંચી ગુણવત્તા વાળા કસ્ટમાઈઝડ શુઝ અને ઈનસોલ વ્યાજબી દરે મળશે.
- ઝડપી સેવા ઉપલબ્ધ
- સરળ અને સમજાય તેવું માર્ગદર્શન
- ૧૦૦% કસ્ટમાઈઝડ ફૂટ કેર ઉપલબ્ધ
- હાઈ ટેક કોમ્પ્યુટરાઈઝડ નિપુણ સેવા
- ત્વરિત નિદાન



1. The Foot Balance Medical expert carries out a manual examination



2. Feet are analysed with the use of prodscope.



3. Pictures are taken of the feet and prodscope.



4. A personalis report of the foot analysis is sent to the customer by email.



5. The heated insoles are moulded to each foot individually while at the same time maintaining correct foot alignment.



6. After each insole is individually moulded they are checked to ensure they conform perfectly to the natural arch of the customer's foot.



7. Custom wedges will be added, if needed.



8. The Foot Balance Medical expert ensures that the customer's footwear is perfectly. Foot Balance custom insoles are now ready to use. Additionally, an individual training programme can be specified for the customer.



પગની માવજત કરો - શરીરનું સમતોલન જાળવો

અમારુ ધ્યેય



અમારા સંશોધન જીવનના કદમ સાથે મિત્ર બનીને કામ કરે છે.



ફૂટ કેર


વિવિધ પ્રકારની પગની તકલીફનું નિવારણ એડવાન્સ કમ્પ્યુટરાઈઝડ ટેકનોલોજીની મદદથી, મલ્ટી ડિસીપ્લીનરી ફૂટ કેરમાં હંમેશા એક કદમ આગળ, ફૂટ એનાલિસીસ અને કસ્ટમ ઈનસોલ્સ.

મલ્ટીડિસીપ્લીનરી ફૂટ કેરમાં હંમેશાં એક કદમ આગળ

ફૂટ એનાલિસીસ અને ૧૦૦% કસ્ટમ ઈનસોલ



- સમસ્યા પર રોક
- નિદાન
- સારવાર/માર્ગદર્શન
- શિક્ષણ



ગુજરાતમાં સૌ પ્રથમ વખત ફૂટ કેર આશુ ફૂટ રિહેબ સેન્ટરની અવશ્ય મુલાકાત લો આશુ રિહેબ (રિહેબ કેર ઉત્પાદન)



તંદુરસ્ત જીવન માટે તંદુરસ્ત પગ



એ/૩, એ.વી. શોપીંગ સેન્ટર, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી અમદાવાદ - ૩૮૦ ૦૦૭. ગુજરાત (ભારત)
ફોન (ઓ.) ૦૭૯ - ૨૬૬૦ ૯૧૯૯, ૨૬૬૦ ૦૭૭૨ મોબાઈલ : ૦૯૮૨૪૦ ૪૭૧૭૮, ૦૯૪૨૬૬૪૭૧૭૮
E-mail : ashufootrehab@gmail.com, Website : www.ashufootrehab.com

૧૦૦% ઉત્તમ રાહત અને સારવાર માટે ૧૦૦% કસ્ટમાઈઝડ ઈનસોલ



ડાયાબીટીસથી શરીરને લાંબા ગાળાની તકલીફો થઈ શકે છે.




ફૂટ પ્રોબ્લેમ : પગ બળવા, પગમાં પીડા થવી, તળિયા સપાટ થવા, એડીમાં પીડા થવી, ઘૂંટણમાંથી સંવેદન જતું રહેવું વગેરે



અમે હંમેશા મેડીકલ નિષ્ણાંતની સાથે રહીને કામ કરીએ છીએ

Common Foot Problems



અમારુ ધ્યેય

દૈનિક જીવનમાં કે રમત-ગમતના ક્ષેત્રમાં આપના પગની યોગ્ય માવજત કરવી, તેની કાર્યક્ષમતા જાળવવી અમારું ધ્યેય છે.

અમે સંશોધન આધારિત ટેકનોલોજી વિકસાવી છે. અને આપના પગની કોઈપણ પ્રકારની તકલીફનું નિવારણ કરવા વિશિષ્ટ પ્રકારના શૂઝ બનાવીએ છીએ.

કાળજી, સુવિધા અને સુખાકારી-આ ત્રણ શબ્દ આપની સેવામાં અમારા માર્ગદર્શક છે. પગના દર્દની તકલીફ વાળા, રમતવીર કે કોઈપણ વ્યક્તિનો સંતોષ અમારુ ધ્યેય છે.

વિશિષ્ટ બનાવટના મોડર્ન ઈનસોલથી પગની તકલીફમાં રાહત. ડાયાબિટીસ, પીઠનો દુઃખાવો, કમરની તકલીફ, હાડકાની બરછટતા, પગમાં લોહી ન પહોંચવું વગેરેથી પગની તકલીફ થતી હોય છે. આવી સમસ્યાઓમાંથી આપના પગને રાહત આપવી અમારુ ધ્યેય છે.

ફૂટ કેર શા માટે અપનાવવું ?

હાડકાની કુદરતી ગોઠવણ જાળવી રાખી શરીરનું યોગ્ય સમતુલન જાળવવા ફૂટ કેર અપનાવવું જરૂરી છે. શરીરનું યોગ્ય સમતુલન જાળવવા હાડકાની કુદરતી ગોઠવણી જાળવવી જરૂરી છે.

ડાયાબિટીસના દર્દી તથા સામાન્ય વ્યક્તિ ના પગની તંદુરસ્તી

ડાયાબિટીસને અટકાવવો એજ એનો સચોટ ઉપાય છે. ડાયાબિટીસને કારણે અનેક સમસ્યા થઈ શકે છે. પગની તકલીફ વાળા દર્દીને યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય ફૂટવેરથી પગની તકલીફમાં રાહત મળી શકે તેમ છે. દુર્ભાગ્યે ડાયાબિટીસ મોટા ભાગના દર્દી પગની તકલીફ જેમ કે પગમાં (ચાંદા પડવા) શરુ થાય પછી ઉપાય શોધવાની શરુઆત કરે છે. મોટેભાગે આ દર્દીઓની પેરીફેરલ ન્યુરોપથીની તપાસ થયેલી હોતી નથી કે તેમને ડાયાબિટીક ન્યુરોપથી સાથે જોડાયેલા જોખમનો ખ્યાલ નથી હોતો આવા દર્દીઓમાંથી જેમને પગની તકલીફ નથી અનુભવાતી તેમને સમજાવવું મુશ્કેલ છે. કે તેમણે એવા જ ફૂટવેર પહેરવા જોઈએ જે તેમના ડોક્ટર તેમને સૂચવે છે. ડાયાબિટીક ફૂટવેરની ટીમ દર્દીની સમગ્ર જરુરિયાતને ધ્યાનમાં લે છે. દર્દી તેમજ ફિઝિશિયન પણ ડાયાબિટીક ફૂટ કેર ટીમના અગત્યના સભ્ય માની શકાય, આ ટીમના બીજા સભ્યોમાં પ્રમાણિત ડાયાબિટીક પ્રશિક્ષક, ફીઝિઓથેરાપીસ્ટ, હાડકાના નિષ્ણાંત કે નર્સનો સમાવેશ થાય છે. પ્રમાણિત હાડકા નિષ્ણાંત (ઓર્થોડિસ્ટ) ઘણી અગત્યની જવાબદારી છે. તે પગની તકલીફનું નિવારણ કરવાના શુઝ અને ઈનસોલની ડીઝાઇન ફિટિંગ, જરૂરી ફેરફાર અને ઉત્પાદન સાથે નજીકથી સંકળાયેલ છે. હાડકાનાં નિષ્ણાંત દર્દીને યોગ્ય માર્ગદર્શન આપે છે. દર્દીએ કેવા પ્રકારના શૂઝ અને ઈનસોલ પસંદ કરવા તેનું માર્ગદર્શન ઓર્થોડિસ્ટ આપે છે અને સાથે સાથે દર્દીના પગને કેવા પ્રકારના શુઝ/ઈનસોલ થી રાહત મળે છે તેની ચકાસણી સમયાંતરે કરે છે.

તમને પગની તકલીફ છે ?
તેના પ્રત્યે બેદરકારી ન રાખો,
આ ગંભીર સમસ્યા છે.....

ફૂટ કેર શા માટે અપનાવવું ?

કોના માટે ફૂટ કેર જરૂરી છે ?

- અતિ ક્રિયાશીલ માણસો - રમત-ગમતમાં પ્રવૃત્ત લોકો
- મેદસ્વી - ડાયાબીટીસથી પગની તકલીફ વાળા લોકો
- વિવિધ પ્રકારની પગની તકલીફ વાળા લોકો માટે

ફૂટ બેલેન્સ



પગના પંજાની જુદી જુદી ઈજાઓ



રમતવીરો અને અતિક્રિયાશીલ માણસો માટે જુદી જુદી જાતના ઈનસોલ



કોમન ફૂટ પ્રોબલેમની ઓળખ



યુવાન રહો, મુક્ત રહો ફૂટ પ્રોબલેમ થી...



માનવતાના સ્પર્શ સાથે હાઈટેક રીહેબ ફૂટ કેર

